



ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છઠ્ઠો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલયાણ રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

Ref no. PN 2025-26/279

Dt. 05/01/2026

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(સેક્રેટરી)

SGCCI દ્વારા MSME એકમો માટે 'કેડિટ ગેરંટી સ્કીમ્સ' પર કાર્યક્રમ યોજાયો

**15 જેટલી યોજનાઓ કાર્યરત છે, એમાંથી ત્રણનો લાભ સુરતના નિકાસકારો-
એમએસએમઈ અને સ્ટાર્ટ અપ્સે અવશ્ય લેવો રહ્યો: શ્રી દુર્ગેશ પાંડે**

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નેશનલ કેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) અને બેંક ઓફ બરોડાની સાથે મળીને શનિવાર, તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ કલાકે ઉષાકાંત કે. મારફતિયા હોલ, સરસાણા, સુરત ખાતે 'કેડિટ ગેરંટી સ્કીમ્સ' વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય MSME એકમો, નિકાસકારો અને સ્ટાર્ટ-અપ્સને સરકાર દ્વારા સંચાલિત કેડિટ ગેરંટી માળખા વિશે માહિતગાર કરી નાણાકીય સુલભતા વધારવાનો હતો.

ચેમ્બરના માનદ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ સ્વાગત સંબોધનમાં કહ્યું કે ચેમ્બર, સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય મંચ મળે અને નિકાસ વધે એ માટે પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નેશનલ કેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC), મુંબઈના CEO અને હોલ-ટાઇમ ડિરેક્ટર શ્રી દુર્ગેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિવિધ સરકારી કેડિટ ગેરંટી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, યોગ્ય માહિતીના અભાવે અનેક નાના ઉદ્યોગસાહસિકો ધિરાણથી વંચિત રહી

જાય છે, જેમને આ યોજનાઓ દ્વારા સરળતાથી લોન મળી શકે છે. તેમણે કહ્યું કે અત્યારે 15 જેટલી ક્રેડિટ ગેરંટી સ્કીમ છે. આમાંથી 3 યોજનાઓ સુરતના ઉદ્યોગકારો માટે ખાસ મહત્વની છે. પહેલી છે નિકાસકારો માટેની યોજના: અમેરિકી ટેરિફને લીધે આ યોજના લાવવામાં આવી. તેમાં 100% ક્રેડિટ ગેરંટી સરકાર આપે છે. સરકાર 20000 કરોડ સુધીનો સપોર્ટ આપવાની છે. બીજી છે એમએસએમઈ માટે મ્યુચ્યુઅલ ગેરંટી સ્કીમ: આ હાઇબ્રિડ મોડલ છે. રિપેનો સમયગાળો ફ્લેક્સિબલ છે અને 2 વર્ષનો મોરેટોરિયમ ગાળો છે. ત્રીજી છે સ્ટાર્ટ અપ સ્કીમ. ઘણાં સ્ટાર્ટ અપ્સ પાસે ફિઝિકલ એસેટ્સ નથી હોતી. તેમાં બેંકોની સાથે એઆઈએફ (ઓલ્ટર્નેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) પણ લોન આપી શકે છે. તેમણે આ ત્રણેય યોજનાઓ વિશે સરળ શબ્દોમાં સમજ આપીને બેંકોને પણ કોલેટરલ પર વધુ ભાર ન મૂકવા ટકોર કરી હતી.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બેંક ઓફ બરોડાના કોર્પોરેટ ઓફિસના ગવર્નમેન્ટ પ્રોડક્ટ્સ MSME હેડ શ્રી રાજકુમાર ગોયલે કહ્યું કે સરકારની વિવિધ યોજનાઓને જાહેર ક્ષેત્રની બેંકો સુપેરે આગળ વધારી રહી છે. એમએસએમઈ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેમણે બેંકિંગ સેક્ટર દ્વારા MSMEs ને આપવામાં આવતા પ્રોત્સાહન-સુવિધા અને બેંક ઓફ બરોડાની ભૂમિકા-ડિજિટલ જર્ની અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે પરોક્ષ નિકાસકારોને પણ આ સ્કીમનો લાભ લેવા આગળ આવવા હાકલ કરી હતી.

બેંક ઓફ બરોડાના શ્રી ચક્રપાણીએ બેંકની MSME પ્રોડક્ટ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ પ્રસંગે ચેમ્બરના માનદ્ બજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરની બેન્કીંગ (કો-ઓપરેટિવ સેક્ટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયના ભક્તા, બેન્ક ઓફ બરોડાના સુરત ઝોનના ડીજીએમ બીડી શ્રી નિર્મલ પટેલ, બેન્ક ઓફ બરોડાના સુરત સિટીના ડીજીએમ એન્ડ રિજીયોનલ હેડ શ્રી મુકેશ નવલ, બેન્ક ઓફ બરોડાના સુરત ઝોનના એજીએમ ક્રેડિટ શ્રી વિવેક કુમાર સિંઘ, ઉદ્યોગકારો અને નિકાસકારો ઉપસ્થિત રહ્યા હતા.

ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની બેંકીંગ (નેશનલાઇઝ્ડ, પ્રાઇવેટ) કમિટીના કો-ચેરમેન સીએ રાજીવ કપાસિયાવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી વક્તાઓનો પરિચય આપ્યો હતો. સત્ર દરમિયાન 'ઓપન હાઉસ' રાખવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત વક્તાઓએ 20 મિનિટ સુધી નિકાસકારો, ઉદ્યોગસાહસિકોના વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.